LORDS ISHWAR HOTELS LIMITED

CIN: L55100GJ1985PLC008264

Date: August 10, 2024

To.

BSE Limited

Department of Corporate Service, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001

Scrip Code - 530065

Sub.: Newspaper advertisement copy of 38th Annual General Meeting, Book Closure and E-voting information.

Dear Sir/Madam,

We are enclosing herewith copy of Newspaper advertisement of 38th Annual General Meeting, Book Closure and E-voting information of the Company published in Financial Express in English and Gujarati Edition.

Kindly take on your record.

Thanking you.

Yours faithfully,

For LORDS ISHWAR HOTELS LIMITED

NEHA PRAJAPATI

Company Secretary



FINANCIAL EXPRESS

HAMILTON POLES MANUFACTURING CO LTD CIN No: L28991WB1981PLC033462 7A, BROJA DULAL STREET, KOLKATA-700006 LINALIDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED ON 30TH JUNE 202

UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED ON 30TH JUNE,2024				
		Rs. L	acs except EPS	
DARTICUL ARC	QUARTER I	ENDED	YEAR ENDED	
PARTICULARS	30-06-2024	30-06-2023	31-03-2024	
	(Unaudited)	(Unaudited)	(Audited)	
Revenue				
Total Income	0.450	10.690	39.310	
Expenses				
Total expenses	1.930	10.350	38.350	
Profit before Exceptional Items and Tax (1 - 2)	(1.480)	0.340	0.960	
Exceptional Items	-	-		
Profit Before Tax (3 - 4)	(1.480)	0.340	0.960	
Tax Expense	-	0.090	0.250	
Profit for the year (5-6)	(1.480)	0.250	0.710	
Other Comprehensive Income (net of tax)				
Total Comprehensive Income for the year	(1.480)	0.250	0.710	
Paid-up equity share capital				
(Face Value of the Share Rs.10/- each)	20,00,000	20,00,000	20,00,000	
Earning Per Share (of Rs.10/-each)				
Basic	-0.740	0.125	0.355	
Diluted	-0.740	0.125	0.355	
Note:				

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI(Listing and Other Disclosure Requirements) Regulations, 2015

For and behalf of Board HAMILTON POLES MANUFACTURING CO LTD Name: PRIYANKA JHA Place: Kolkata Designation : Managing Director Date: 09.08.2024 DIN: 08943236

LECS LAKSHMI ELECTRICAL CONTROL SYSTEMS LIMITED Regd. Office: 504, Avinashi Road, Peelamedu Post, Coimbatore - 641004 CIN: L31200TZ1981PLC001124

STATEMENT OF UNAUDITED RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024 (₹ in Lakhs)

203	D RE-REPORTED	3 Month	s Ended	12 Months Ender	
SL No	Particulars	30.06.2024 (Unaudited)	30.06.2023 (Unaudited)	31.03.2024 (Audited)	
1.	Total income from operations	5,141.93	9,279.15	33,796.50	
2.	Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)	128.66	750.01	1,905.68	
3.	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional items)	84.63	750.01	1,891.68	
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional Items)	82.70	553.11	1,396.0	
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after Tax)] and other Comprehensive Income (after Tax)]	1,515.81	2,677.72	5,495.18	
6.	Equity Share Capital (Face value of Rs.10/- each)	245.80	245.80	245.80	
7.	Other Equity (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	225	57	27,906.4	
8.	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) Basic : Diluted :	3.36 3.36	22.50 22.50	56.79 56.79	

The above is an extract of the detailed format of Quarterly Unaudited Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Unaudited Results are available on the Stock Exchange website - BSE Limited (www.bseindia.com) and on the Company website (www.lecsindia.com)

By order of the Board NETHRA J. S. KUMAR Coimbatore Chairperson and Managing Director 09.08.2024



GUJARAT HOTELS LIMITED

CIN: L55100GJ1982PLC005408 Regd. Office: WelcomHotel Vadodara, R C Dutt Road, Alkapuri, Vadodara - 390 007 Tel.: +91 0265 2330033

E-mail: ghlinvestors@yahoo.co.in Website: www.gujarathotelsltd.in

NOTICE

Members are hereby informed that the 42nd Annual General Meeting ('AGM') of the Company will be held on Thursday, 12th September, 2024 at 11:00 a.m. (IST) through Video Conferencing / Other Audio Visual Means, in conformity with the applicable provisions of the Companies Act, 2013 ('the Act') and the Rules thereunder read with the Circulars issued by the Ministry of Corporate Affairs, Government of India.

The Notice of the 42nd AGM ('AGM Notice') and the Report and Accounts 2024, in conformity with the applicable regulatory requirements, will be sent only through electronic mode to those Members who have registered their e-mail addresses with the Company or with the Depositories. The AGM Notice and the Report and Accounts 2024 will be available on the Company's website (www.gujarathotelsltd.in) and on the website of BSE Limited (www.bseindia.com), where the Company's shares are listed. The Company will also provide physical copies of the AGM Notice and the Report and Accounts 2024 to the Shareholders upon request.

In terms of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Resolutions for consideration at the 42nd AGM will be transacted through remote e-voting (i.e. facility to cast vote prior to the AGM) and also e-voting during the AGM, for which purpose the services of National Securities Depository Limited ('NSDL') have been engaged by the Company.

Members who hold shares in the certificate form or who have not registered their e-mail addresses with the Company or with the Depositories and wish to receive the AGM Notice and the Report and Accounts, 2024, or attend the AGM, or cast their votes through remote e-voting or e-voting during the AGM, are required to register their email addresses with the Company by filling the form available on Company's website at https://www.gujarathotelsltd.in/2021/ investor-relations/shareholders-communication/ISR-1.pdf. Members holding shares in dematerialised form are requested to register / update their email addresses with the relevant Depositories.

The Final Dividend of ₹2.50 per Equity Share of ₹10/- each recommended by the Board of Directors of the Company for the financial year ended 31st March, 2024, if declared at the 42nd AGM, will be remitted, after deduction of tax at source, through electronic mode to those Members who have furnished their required bank details to the Company/ the respective Depository Participants (DPs). Members who have not opted for remittance of dividend through electronic mode and wish to avail the same, are required to provide their bank details, including IFSC ('Indian Financial System Code') and MICR ('Magnetic Ink Character Recognition') to the respective DPs, in case shares are held in dematerialised form, or to the Company, in case shares are held in certificate form on or before 23rd August, 2024, failing which dividend warrants/ demand drafts will be sent to their registered address. Members holding shares in the certificate form may use the prescribed form for this purpose, which may be accessed on the Company's website at https://www.gujarathotelsltd.in/ 2021/investor-relations/shareholders-communication/ISR-1.pdf, or can be furnished by the Company on request.

Guiarat Hotels Limited Swati Date: 9th August, 2024 Company Secretary

JMJ FINTECH LIMITED (Formerly Known as Meenakshi Enterprises Limited)

CIN: L51102TZ1982PLC029253 Regd Office: Shop No. 3, 1st Floor, Adhi Vinayaga Complex, No. 3, Bus Stand Gopalsamy Temple Street, Ganapaty, Colmbatore North, Tamil Nadu - 641006 Email: investor@jmjfintechitd.com | Website: www.jmjfintechitd.com | Ph. No. : 7395922291/92 Extract of Statement of Unaudited Financial Results

_	for the Quarter	Ended 30	0.06.2024	1	(Rs in Lakhs)
L.Y.	AND	Q	Year Ended		
SI. No.	Particulars	30-06-2024 (Unaudited)	CONTROL SERVICE	30-06-2023 (Unaudited)	
1.	Total Income from operations (net)	369.20	306,55	78.47	746.75
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary Items)	244.16	164.25	18.86	385.76
3.	Net Profit / (Loss) for the period (before Tax and after Exceptional and / or Extraordinary Items)	244.16	164.25	18.86	385.76
4.	Net Profit / (Loss) for the period (after Tax and after Exceptional and / or Extraordinary Items)	182.26	46.22	18.86	213.78
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	182.26	46.22	18,86	213.78
6.	Equity Share Capital	1240.00	1240.00	1240.00	1240.00
7:	Earnings per Share (before extraordinary items (of Rs. 10/- each) for continued and discontinued operations	0.00	0.00	0.00	0.00
	Basic and Diluted	1.47	0.37	0.15	1.72

Above notes were reviewed by Audit Committee and approved by the Board of Directors in

- their Board Meeting held on 09.08.2024.
- Figures for the Prior Period / years have been re-grouped and/or Classified whereve considered necessary. The Statutory Auditors of the Company have carried out the Limited Review of the above
- quarterly Financial results.

Current Tax includes Net tax of MAT Credit. Segmental Report for the Quarter as per IND-AS 108 is not applicable.

For JMJ FINTECH LIMITED JOJU MADATHUMPADY JOHNY

PLACE: COIMBATORE MANAGING DIRECTOR DATE: 09-08-2024 DIN: 02712125

> KALPATARU ENGINEERING LIMITED Registered Office: 18, RABINDRA SARANI, PODDAR COURT. GATE NO 4, 4TH FLOOR, ROOM NO 4, KOLKATA-700001 CIN:L27104WB1980PLC033133 STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024 Rs. Lacs except EPS

	Rs. Lacs except EPS				
_		QUARTE	R ENDED	YEAR ENDED	
SI	PARTICULARS	30-Jun-24	30-Jun-23	31-Mar-24	
No.		(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Revenue				
	Total Income	6.56	9.27	186.57	
2	Expenses				
	Total expenses	5.65	8.19	175.57	
3	Profit before Exceptional Items and Tax (1 - 2)	0.91	1.08	11.00	
4	Exceptional Items	0.00	0.00	0.00	
5	Profit Before Tax (3 - 4)	0.91	1.08	11.00	
6	Tax Expense	0.24	0.28	2.86	
7	Profit for the year (5-6)	0.67	0.80	8.14	
8	Other Comprehensive Income (net of tax)				
9	Total Comprehensive Income for the year	0.67	0.80	8.14	
10	Paid-up equity share capital				
	(Face Value of the Share Rs. 10/- each)	18,21,34,000	18,21,34,000	18,21,34,000	
11	Earnings per share (of Rs. 10/- each):				
	(a) Basic	0.004	0.004	0.045	
337)	(b) Diluted	0.004	0.004	0.045	

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI(Listing and Other Disclosure Requirements) Regulations, 2015.

For Kalpataru Engineering Limited Sailen Roy

Place: Kolkata **Managing Director** Date: 09/08/2024 DIN No. 09673558

Morn Media Limited

Regd. Office:- Jagran Building, 2, Sarvodaya Nagar, Kanpur - 208 005 CIN:- L22121UP1983PLC006177 ISIN:- INE343T01016 Tel.No:- 0512-2216161, E-mail:- mommedialimited@hotmail.com

Website:- www.mornmedia.com Extract of Unaudited Financial Results for the Quarter ended June 30, 2024 (Amount Rs. in Lakhs, except per share data)

	Quarter Ended	Year Ended	Quarter Ended
Particulars	30.06.2024	31.03.2024	30.06.2023
5 - 10 - 10 - 10 - 10 - 10 - 10 - 10 - 1	(Unaudited)	(Audited)	(Unaudited)
Total income from operations	-	-	3
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	0.14	2.15	0.64
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	0.14	2.15	0.64
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	0.11	2.12	0.73
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	0.11	2.12	0.73
Equity Share Capital (Face value Rs. 10 per share)	50.00	50.00	50.00
Reserves (excluding revaluation reserve)	73.33	73.22	71.83
Earnings Per Share (Face value of Rs. 10\- each) (not annualized) (in Rs.)			
- Basic	0.02	0.42	0.15
- Diluted	0.02	0.42	0.15

. The above is an extract of the detailed format of quarter ended June 30, 2024 Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results are available on the websites of the Stock Exchange www.msei.in and also available on the Company's website www.mommedia.com . The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at the

meeting held on August 9, 2024. By the Order of the Board For Morn Media Limited Pramod Kumar Nigam

Date: August 09, 2024 Place: Kanpur DIN-07575887

THE INDIAN WOOD PRODUCTS CO. LTD. CIN: L20101WB1919PLC003557

Regd Off: 9 Brabourne Road, 7th Floor, Kolkata- 700 001 Website: www.lwpkatha.com; Email id: lwpho@iwpkatha.co.in Tel. 033 40012813, Fax No. 033 22426799 NOTICE OF THE 104th ANNUAL GENERAL MEETING AND E-VOTING

Notice is hereby given that the 104th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Tuesday, 10th September 2024 at 3.00 P.M., Indian Standard Time ("IST"), through Video Conference ("VC")/Other Audio-Visual Means ('OAVM') without the physical presence of Members at the venue to transact the business as set out in the notice of the 104th AGM.

In this regard, Members are informed that the Company has completed electronic dispatch of the Annual Report of the Company for the financial year 2023-24 inter alia, comprising of Directors' Report, Auditors Report, Standalone and Consolidated Annual Audited Financial Statements of the Company for the year ended 31st March 2024 along with the Notice of the 104th Annual General Meeting, on 09th August 2024, through an email to the members whose email addresses are registered with the Company or Depositories Participants, as the case may be, and whose names appear as in the register of members/beneficial owners as on 02nd August 2024.

remote e-voting. M/s. National Securities Depository Limited (NSDL) has been engaged to provide the remote e-voting platform to the shareholders of the Company. The remote e-voting shall begin on Saturday, 07th September 2024 at 9.00 AM and ends on Monday, 09th September 2024 at 5.00 PM., thereafter remote e-voting will be disabled. Once a vote is cast by the Members, he/she shall not be allowed to change it subsequently. Members who have voted through remote e-voting shall be eligible to attend the AGM through VC, however, they shall not be eligible to vote at the meeting. The Company will make necessary arrangements for e-voting during the AGM.

A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as of the cut-off date of 03rd September 2024, shall be entitled to avail the facilities of remote-e voting as well as e-voting in the AGM. Persons, who become members of the Company subsequently to the dispatch of the Notice/Email and hold the shares as on the cut-off date of 03rd September 2024 are requested to send the written /email communication to the Company at iwpho@iwpkatha.co.in, by mentioning their Folio No./DP ID and client ID to obtain the Login-ID and Password for e-voting.

The Notice is available on the website of the Company: www.iwpkatha.com and NSDL: https://www.evoting.nsdl.com.

Any grievance relating to the e-voting should be addressed to Mr. Anup Gupta, Company Secretary, The Indian Wood Products Co. Ltd, 9 Brabourne Road, 7th Floor, Kolkata-700001, Telephone No.: 033 40012813, Email id: iwpho@iwpkatha.co.in. Further, in case you have any queries or issues regarding e-voting, you may refer to the Frequently Asked Questions ("FAQ") and e-voting manual available at www.evoting.nsdl.com under the help section or write an email to helpdesk.evoting@nsdlindia.com.

Place: Kolkata

Dated: 09.08.2024

By order of the Board For The Indian Wood Products Co. Ltd Anup Gupta

Pyramid Technoplast Limited

CIN: L28129MH1997PLC112723 Regd. Off: Office No.2, 2nd Floor, Shah Trade Centre, Rani Sati Marg, Near W.E Highway, Malad (East), Mumbai-400097

https://pyramidtechnoplast.com / info@pyramidtechnoplast.com Statement of Un-Audited Financial Results for the Quarter ended June 30, 2024

As, in Lakhs (except earnings per share)

		Qu	Year Ended		
Sr. No.	PARTICULARS	30-Jun-24	31-Mar-24	30-Jun-23	31-Mar-24
	2026 S.C. 1808 V.C. 100 V.C. 12	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)
1	Revenue from operation	13,362.47	13,365.42	13,851.70	53,242.26
2	Profit/Loss Before Exceptional Items and tax	1,010.24	1,048.34	1,032,93	4,009.87
3	Profit/(Loss)before tax	1,010.24	1,048.34	1,032.93	4,009.87
4	Net Profit/(Loss) after tax	756.70	729.36	775.73	2,934.21
5	Total Comprehensive Income for the year (after tax)	759.20	706.82	781.93	2,930.02
6	Paid-up Equity Share Capital (Face Value of Rs.10 /- each)	3,678.48	3,678.48	3,128.48	3,128.48
7	Earnings per Equity Share (of Rs. 10'- each)				
	Basic	2.06	1.92	2.50	8.49
	Diluted	2.06	1.92	2.50	8.49

Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) i.e https://www.bseindia.com/.

> For and on behalf of the Board of Directors of, Pyramid Technoplast Limited

Jaiprakash Agarwal Wholetime Director and CFO Date: 10.08.2024 DIN: 01490093

BY ORDER OF THE BOARD

SMS LIFESCIENCES INDIA LIMITED

CIN: L74930TG2006PLC050223 Registered office: Plot.No. 19-III. Road No.71, Opp. Bharativa Vidva Bhavan

Public School, Jubilee Hills, Hyderabad-500 096. Phone.No: 040-66288888 Fax: 040-23551401, Website: www.smslife.in, E-mail cs@smslife.in

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024 (in Lakhs)

SI.		Quarte	r ended	Year ended	
No.	Particulars	30.06.2024 [Unaudited]	30.06.2023 [Unaudited]	31.03.2024 [Audited]	
1	Total Income from Operations	9,254.82	7,465.16	30,595.84	
2	Net Profit/ (Loss) (before tax, Exceptional items)	1,064.03	(272.65)	984.67	
3	Net Profit/ (Loss) before tax (after Exceptional items)	1,064.03	(272.65)	984.67	
4	Net Profit/ (Loss) after Tax (after Exceptional Items)	709.63	(382.87)	632.78	
5	Total Comprehensive Income (comprising profit/Loss after tax) and other comprehensive income)	687.78	(178.63)	865.54	
6	Equity Share Capital (Face value: ₹ 10/- each)	-	-	302.33	
7	Other Equity (excluding Revaluation Reserve)		Ī	17,379.09	
8	Earnings per share (after Exceptional items) ** **Basic /Diluted in ₹	23.15	(5.94)	30.08	

INC	OTES:			
a)	Standalone Results		(₹ in Lakhs)
		Quarte	r ended	Year ended
	PARITCULARS	30.06.2024	30.06.2023	31.03.2024
		[Unaudited]	[Unaudited]	[Audited]
	Total Income from Operations	8,657.06	7,455.99	30,000.16
	Net Profit before Tax	953.69	135.81	1,911.23
	Net Profit after Tax	645.99	70.05	1,306.54
	Total Comprehensive Income	634.66	71.30	1,265.35

b) The above Standalone and consolidated Financial Results have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on August 9, 2024.

c) These results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IndAS) prescribed Under Section 133 of the Companies Act. 2013 and other recognized accounting principals to the extent applicable.

d) The above is an extract of detailed format of Standalone and Consolidated results for quarterly results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The full format of quarterly financial results are available on the website of the Stock Exchanges of BSE (www.bseindia.com) & NSE (www.nseindia.com) and Company' website (www.smslife.in). By order of the Board

for SMS LIFESCIENCES INDIA LIMITED TVVSN Murthy Place: Hyderabad Managing Director DIN: 00465198 Date: 09-08-2024

BENGAL & ASSAM COMPANY LIMITED

Consolidated Financial Results (Unaudited) for the Quarter ended 30th June, 2024

SIL		Quarter	Year Ended	
No.	Particulars	30.06,2024	30.06.2023	31.03.2024
1	Total Income from operations	52,827.17	4,24,059.59	12,91,741.19
2	Profit before Interest, Depreciation & Taxes (PBIDT)	9,996.38	54,405.75	1,94,995.18
3	Net Profit for the period (before Tax and Exceptional Items)	7,317.05	29,495.65	1,21,241,17
4	Net Profit for the period (before Tax but after Exceptional Items)	7,317.05	29,930.65	4,10,923.51
5	Net Profit for the period (after Tax and Exceptional Items)	25,641.23	37,780.16	4,19,357.55
6	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	22,899.40	40,446,22	4,15,762.75
7	Equity Share Capital	1,129.63	1,129.63	1,129.63
8	Other Equity excluding Revaluation Reserve as shown in Audited Balance Sheet as of 31 ⁵¹ March, 2024			9,04,418.70
9	Earnings per share of ₹ 10/- each			
	- Basic and Diluted (₹) - after Exceptional flem	219.90	263,66	3,444.99
	- Basic and Diluted (₹) - before Exceptional Item	219.90	262,34	1,112.09

[Listing Obligations and Disclosure Requirements] Regulations, 2015. (₹ in Lakhs) Quarter Ended Year Ended **Particulars** 30.06.2024 30.06.2023 31.03.2024 15,958.07 1 Revenue 497.29 383.79 Profit before Interest, Depreciation 14,900.59 & Taxes (PBIDT) 357.51 250.65 13,789.30 (84.46)3 Profit before Tax 174.26 4 Profit After Tax 186.00 (93.87)11,574.78

Notes: Consolidated results are not strictly comparable as JK Tyre & Industries Ltd. ceased to be a subsidiary and became an Associate w.e.f 23rd December, 2023.

 The above is an extract of the detailed format of Quarter ended 30th June, 2024. Financia Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Financial Results are available on the website of Stock Exchange at www.bseindia.com and also on Company's website at www.bengalassam.com.

For Bengal & Assam Company Limited

(Bharat Hari Singhania) Place: New Delhi Date: 09.08.2024 For Kind attention of Shareholders : As a part of Green initiative of the Government, all the

Admin. Office: Patriot House, 4th Floor, 3, Bahadur Shah Zafar Marq. New Delhi-110002, Phone: 91-11-66001112 Regd. Office: 7, Council House Street, Kolkata-700 001 Telephone No. 033-22486181, Fax No. 033-22481641 CIN: L67120WB1947PLC221402

Website: www.bengalassam.com, E mail ID: dswain@jkmail.com

Shareholders are requested to get their email addresses registered with Company for receiving

KERALA WATER AUTHORITY e-Tender Notice

Tender No: SE/PHC/KKD/22/2024-25

AMRUT-2.0-Kozhikode Water Supply Project-Malaparamba Zone-Replacing old Premo pipe at Malaparamba Water tank to Eranhipalam-Pipeline Work, EMD: Rs. 500000, Tender fee: Rs. 16540+2978(GST), Last Date for submitting Tender: 23-08-2024 04:00:pm, Phone: 0495 - 2371046, Website: www.kwa.kerala.gov.in, www.etenders.kerala.gov.in

Superintending Engineer KWA-JB-GL-6-386-2024-25 PH Circle Kozhikode

LORDS ISHWAR HOTELS LIMITED

CIN: L55100GJ1985PLC008264 Hotel Revival, Near Sayaji Garden, Kala Ghoda Chowk, University Road, Baroda- 390 002, Gujarat (India) Tel: 0265 2793545 Email- info@lordsishwar.com , web: www.lordsishwar.com NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE &

REMOTE E-VOTING INFORMATION NOTICE IS HEREBY GIVEN that the 38th Annual General Meeting (AGM) of the Company will be held on Tuesday, the 03rd day of September, 2024 at 11:00 a.m. through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) to transact the business set out in

Electronic copies of the Notice of AGM and Annual Report for the year 2023-24 have been sent to the shareholders whose email IDs are registered with the Company/Depository Participants. The same is also posted on the Company's website www.lordsishwar.com Further, Notice is hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rules thereon and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer

Book of the Company will remain closed from August 28, 2024 to September 03, 2024 (both days inclusive). In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide its members the facility of 'remote e-voting' to cast his/her vote electronically in respect

of the business set forth in the Notice and the following details are given below: (a) The remote e-voting shall commence at 9.00 a.m. on August 31, 2024;

(b) The remote e-voting shall end at 5.00 p.m. on September 02, 2024; (c) The cut-off date is August 27, 2024 i.e. the date for determining the eligibility to vote by

electronic means or in the AGM; (d) Any person who acquires shares of the company after dispatch of the Notice and holding shares as of the cut-off date, may obtain login ID & password by sending an email to evoting@nsdl.co.in and if already registered with NSDL, then exiting user ID & password can

be used for remote e-voting; (e) (i) Remote e-voting shall not be allowed beyond 05.00 p.m. on September 02, 2024; (ii) The facility for voting by remote e-voting shall be made available at the AGM for all those members who are present during the meeting through VC/OAVM but not cast their

votes by availing the remote e-voting facility. The remote e-voting module during the AGM shall be disabled by NSDL for voting 15 minutes after the conclusion of the Meeting: (iii) A person, whose name is recorded in the register of members or in the register of

beneficial owners maintained by the depositories as on the above cut-off date, only shall be entitled to avail the facility of remote e-voting or voting during the AGM; (f) The Notice of AGM is also available on the Company's website www.lordsishwar.com

and website of NSDL www.evoting.nsdl.com; and (g) Contact details of the person responsible to address the grievances connected with

the remote e-voting: Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL Mumbai. Email: evoting@nsdl.com, Tel: 022-48867000 For e-voting instructions in detail, please go through the Notes to the AGM Notice sent to you.

By Order of Board of Directors For Lords Ishwar Hotels Limited

Neha Prajapati Place: Vadodara Company Secretary Date: August 09, 2024

WELCAST STEELS LIMITED (CIN: L27104GJ1972PLC085827)

Read, Office: 115-116, G.V.M.M. Estate, Odhav Road, Odhav, Ahmedabad - 382 415.

Website: www.welcaststeels.com; Email: Info@welcaststeels.com Phone: 079-22901078, Fax: 079-22901077.

NOTICE OF 52ND ANNUAL GENERAL MEETING,

E-VOTING INFORMATION AND BOOK-CLOSURE

Notice is hereby given that the 52nd Annual General Meeting (AGM) of the Company i scheduled to be held on Monday, the 2nd September, 2024 at 11.00 a.m. through Video Conference (VC)/ Other Audio Visual Means (OAVM), to transact the Ordinary and Specia Businesses, as set out in the Notice of the 52nd AGM in compliance with Circular No 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 20/2020 dated May 5, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 02/2022 dated May 5, 2022, Circular No. 10/2022 dated December 28, 2022 and Circula No. 09/2023 dated September 25, 2023 issued by the Ministry of Corporate Affairs and also Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/CFD /CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, Circular No. SEBI/HO/CFD/PoD-2 P/CIR/2023/4 dated January 5, 2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIF /2023/167 dated October 7, 2023 issued by the Securities and Exchange Board of India.

The Notice of AGM along with the Annual Report inter alia, including the remote e-voting instructions has been sent in electronic mode to all the members whose e-mail IDs are registered with the Company or Depository Participant(s). The Notice of AGM along with the Annual Report for Financial Year 2023-24 can be downloaded from the website of the Company: www.welcaststeels.com and website of the Stock Exchange i.e. BSE Limited www.bseindia.com and website of Central Depository Services (India) Limited (CDSL) www.evotingindia.com

Remote E-Voting and E-Voting during AGM: Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of

the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules") as amended and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is providing its members, the facility to exercise their right to vote by electronic means on all the business to be transacted as set forth in the Notice of AGM of the Company through the remote e-voting facility provided by CDSL. The detailed instructions for remote e-voting facility are contained in the Notice of the AGM which has been sent to

The details pursuant to the provisions of the Companies Act, 2013 and the Rules are giver

1. Cut-off date for the purpose of remote e-voting: Monday, 26th August, 2024. 2. Date and time of Commencement of remote e-voting: From Thursday, 29th August, 2024 at 9.00 a.m.

3. Date and time of end of remote e-voting: Upto Sunday, 1st September, 2024 at 5.00 p.m Remote e-voting shall not be allowed beyond the said time and date. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The Members who have cast their votes by remote e-voting prior to the AGM can also attend/participate in the AGM through VC/OVAM but shall not be entitled to cast their votes again.

4. Persons who have acquired shares and become members of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e. 26th August, 2024 may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM.

5. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the AGM. 6. The manner of remote e-voting and e-voting during the AGM for shareholders holding

shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses has been provided in the Notice sent to the members. 7. In case Member(s) have not registered their e-mail addresses with the Company Depository, please follow the below instructions to register e-mail address for obtaining

Annual Report and login details for e-voting: a. For Members holding shares in Physical mode are requested to update e-mail id and mobile no. by providing Form ISR-1 and Form ISR-2 available on the website of the Company at the link http://www.welcaststeels.com/newsite/Shareholderservicekyc.html as well as on the website of the Registrar and Share Transfer Agent ("RTA") at the link

https://www.bigshareonline.com/Resources.aspx. b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant.

8. In case you have any queries or issues regarding e-voting, you can refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com under help section or write an e-mail to helpdesk.evoting@cdslindia.com or call at to free no.: 1800 22 55 33.

9. All grievances connected with the facility for voting by electronic means can be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mills Compound, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400 013 or send an e-mail to helpdesk.evoting@cdslindia.com or call at toll free no.: 1800 22 5533. 10. In order to get the dividend amount credited directly in the bank account, the members

Card, Cancelled Cheque, passbook, a request letter duly signed along with Form ISR - 1 by Registered Member to RTA. The members holding shares in demat mode, can approach their depository participant with whom they hold the demat account. Pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer Book of the Company will remain closed from Tuesday, 27th

Date: 09.08.2024

Place: Ahmedabad

holding shares in physical mode can provide self-attested copies of PAN Card, Aadhar

August, 2024 to Monday, 2nd September, 2024 (both days inclusive) for the purpose of AGM and to determine the members entitled to receive dividend.

Company Secretary

For Welcast Steels Limited S. N. Jetheliya

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.





Company Secretary

Rs Lacs except EPS



र्गिट्डियन **ओ**वरसी७ ॲंड

શાખા : આશિર્વાદ પ્રિન્ટીંગ પ્રેસ સામે, કનકેશ્વર મહાદેવ મંદિર પાસે, જેતપુર, જી. રાજકોટ, પીન-૩૬૦ ૩७૦ ઈ-મેઇલઃ iob0400@iob.in, ફોન ૦૨૮૨૩- ૨૨૦૧૨૪

માંગણા નોટીસ

सिड्योरिटी छल्टरेस्ट (એन्डोर्समेन्ट) रुट्स, २००२ (रुट्स)ना रुख ३(१) साथे पंचाता सिड्योरिटाछग्रेशन એन्ડ रीइन्स्ट्रुडशन ओड़ ड्राइनान्सियस એसेट्स એन्ડ એन्डोर्समेन्ट ओड़ सिड्योरिटी छल्टरेस्ट એક्ट, २००२ना (सरड़ेसी)ना सेडशन ९३(२) ढेढण 💶 આથી ઈન્ડીયન ઓવરસીઝ બેકના અધિકૃત અધિકારી તેરીકે સરફેસી એક્ટ હેઠળ અને રૂલ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સંતાની રૂએ કથિત એક્ટની કલમ ૧૩(૨) હેઠળ

ર. બાલ ઇન્ડાના અને આવેદદારો/જામીનદારો (હવે પછી અહીં નીચે "કથિત દેવાદારો" તરીકે સંદર્ભિત)ને નોટીસમાં જણાવ્યા મુજબની રકમો, અહીં નીચે આપેલી વિગતો મુજબ, નોટીસ મળવાની તારીખથી દૃંઠ દિવસોની અંદર પરત ચૂકવવા જણાવ્યું હતું. ર. કથિત નોટીસો પોસ્ટલ ઓથોરિટીઝ દ્વારા વિતરિત ન થવાને લીઘે / દેવાદારો/ગીરવેદારો/જામીનદારો દ્વારા ચોગ્ચ રીતે સ્વીકૃત ન થવાને લીઘે પરત આવી છે. તેથી બેંક ખૂબ સાવદાનીપૂર્વક ડિમાન્ડ નોટીસોનું આ પ્રકાશન કરી રહી છે. નીચે સહીકરનારે કથિત એક્ટ મુજબ, તેથી, કથિત દેવાદારો/ગીરવેદારો/જામીનદારો નો છેલ્લા જાણીતા સરનામાના પ્રિમાઇસીસ પર આ નોટીસો ચોટાડવાની થઇ છે. કથિત નોટીસોની નકલો નીચે સહીકરનાર પાસે ઉપલબ્ધ છે અને કથિત દેવાદારો/ગીરવેદારો/જામીનદારો, જો તેઓ ઇચ્છે તો, તેઓ નીચે સહીકરનાર પાસે ઉપલબ્ધ છે અને કથિત દેવાદારો/ગીરવેદારો/જામીનદારો, જો તેઓ ઇચ્છે તો, તેઓ નીચે સહીકરનાર

પાસેથી કથિત નકલો કોઇપણ કામકાજના દિવસોએ ઓફિસ કલાકો દરમ્યાન મેળવી શકે છે.

3. ઉપરોક્ત પૃષ્ઠભૂમિની વિરુદ્ધ, કથિત દેવાદારો/ગીરવેદારો/જમીનદારોને ઇન્ડીયન ઓવરસીઝ બેંકને લોન અને અન્ય દસ્તાવેજો હેઠળ નીચે આપ્યા મુજબ દશવિલી/યૂક્વવાપાત્ર રકમોની, આ નોટીસ પ્રકાશિત થયાની તારીખથી દ્દ૦ દિવસ ની અંદર ચૂકવણી કરવાની, અહીં ફરીથી નોટીસ આપવામાં આવે છે. લોનની બાકી પુનઃચૂકવણીની સિક્ચોરીટી માટે, સંબંધિત પાર્ટીઓ દ્વારા ઇન્ડીયન ઓવરસીઝ બેંકને હાઇપોથીકેટેડ કરવામાં આવેલી મિલકતો નીચે મુજબ છે.

સં. ક.	દેવાદાર/ગીરવેદાર/જામીનદારના નામ સાથે સરનામું	કુલ લેણી નીકળતી રકમ* રૂા.માં ૦૧.૦૯.૨૦૨૪ મુજબ	સિક્યોર્ડ મિલકતનું વર્ણન	ડીમાન્ડ નોટિસની તારીખ
1	મે. ચંદન પ્રિન્ટર્સ (અગાઉની મેસર્સ ચંદન ટ્રેડિંગ કંપની) (પાર્ટનર્સ ૧. શંભુભાઈ કરમસીભાઈ ગજેરા, ૨. નરકાભાઈ કરમસીભાઈ ગજેરા, ૩. વ્રજલાલ કરમસીભાઈ ગજેરા) કરામે આ કરમસીભાઈ ગજેરા) કરામો કરનામું:-શ્રીનાથજી ઉદ્યોગ નગર, બીએપીએસ સ્વામી નારાયણ મંદિરની પાછળ, જૂનાગઢ રોડ, જેતપુર, રાજકોઢ જિલ્લો-3૬૦૩૭૦	રા. ૬૧,૯૨,૩૧૦/– (કેશ કેડિટ) રા. ૧૩,૨૩,૦૨૯/– (ટર્મ લોન)	હાઈપોથીકેશન સ્ટોક, બુક ડેટ અને મશીનરી મેસર્સ દ્વારા બેંકના ફાઇનાન્સમાંથી હસ્તગત. ચંદન પ્રિન્ટર્સ શ્રીનાથજી ઉદ્યોગ નગર, બીએપીએસ સ્વામી નારાચણ મંદિરની પાછળ, જૂનાગઢ રોડ, જેતપુર, રાજકોટ જિલ્લો–3૬૦૩૭૦ ખાતે આવેલું છે.	01.07.2024
2	શ્રી શંભુભાઇ કરમશીભાઇ ગજેરા કરમશીભાઇ ગજેરાના પુત્ર (ગીરવેદાર/જામીનદાર) સરનામું : બ્લોક નં. ૨, અમરનગર રોડ, અમિધારા એપાર્ટમેન્ટ, સરદાર ચોક, જેતપુર, જીલ્લો રાજકોટ- ૩૬૦૩૭૦		ફેક્ટરી બિલ્ડિંગનો તમામ પાર્ટ અને પાર્સલ અને પ્લોટ નં. ૧ અને ૨, સર્વે નંબર ૩૬ પૈકી, એ. ૨-૦૫ જી, શ્રીનાથજી ઉદ્યોગનગર, લાયન્સ સ્કૂલ પાછળ અને બીએપીએસ સ્વામી નારાયણ મંદિર પાછળ, જૂનાગઢ રોડ, જેતપુર જિ. રાજકોટ- ૩૬૦૩૦૦ ખાતે સ્થિત જે શ્રી શંભુભાઇ કરમસીભાઇ ગજેરા, શ્રી નશ્શીભાઇ કરમસીભાઇ ગજેરા અને શ્રી વ્રજલાલ કરમશીભાઇ	
3	શ્રી નરશીભાઇ કરમશીભાઇ ગજેરા કરમશીભાઇ ગજેરાના પુત્ર (ગીરવેદાર/જામીનદાર) સરનામું : શ્રીનાથજી કૃપા, જુનાગઢ રોડ, પેટલ નગર, સરદાર ચોક, અમિદ્યારા એપાર્ટમેન્ટ પાસે, જેતપુર, જીલ્લો રાજકોટ-3૬૦૩૭૦		ગજેરાના નામે. ચતુ:સીમા નીચે મુજબ: ઉત્તરે : કૃષિની ખેતીની જમીન આર. એસ. નંબર 3૭, દક્ષિણે: રોડ, પૂર્વે : પ્લોટ નં. 3, પક્ષિમે: એન. એ. જમીન આર. નં. ૩૫. કુલ વિસ્તાર: ૨૨૧૯.૧૦ ચોરસ મીટર ચો. મીટર	
4	શ્રી વાલજી કરમશીભાઈ ગજેરા કરમશીભાઈ ગજેરાના પુત્ર (ગીરવેદાર/જામીનદાર) સરનામું : શ્રીનાથજી કૃપા, જુનાગઢ રોડ, પેટલ નગર, સરદાર ચોક, અમિધારા એપાર્ટમેન્ટ પાસે, જેતપુર, જીલ્લો રાજકોટ-3૬૦૩૭૦			

* ઉપર જણાવેલ તારીખથી ચૂકવણીની તારીખ સુધી કરારી દરે આગળના વ્યાજ/સંમત થયા મુજબ બાકી સહિત ચૂકવવાપાત્ર

ેલપર વહાલલ તારાખથા સુક્વણાના તારાખ સુધા કરાશ દર આગળના વ્યાપ¦તમત થયા મુજબ બાકા તાહત સુક્વવાપા? *૧. જો કલિત દેવાદાર]/જોમીનદારો ઇન્ડીયલ ઓવરસીઝ બેંકને ઉપર જણાવ્યા મુજબની ચૂકવણી કરવામાં નિષ્ફળ જશે તો ઇન્ડીયન ઓવરસીઝ બેંક સરફેસી એક્ટ અને રૂસ્સની કલમ ૧૩(૪) હેઠળ સમગ્રપણે કથિત દેવાદાર]/ગીરવેદારો/જામીનદારોના જોખમે , ખર્ચે અને પરિણામોએ સિક્યોર્ડ મિલકતો વિરુદ્ધ કાર્યવાહી કરશે .

પ. વધુમાં , દેવાદારો/ગીરવેદારો/જામીનદારોનું તેમને ઉપલબ્ધ સમચમાં સિક્યોર્ડ મિલકતો પરત મેળવવા માટેની એક્ટની કલમ ૧૩ની પેટા કલમ(૮)ની જોગવાઇઓ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે. કે લિલ દેવાદારો/ગીરવેદારો/જામીનદારો સરફેસી એક્ટ હેઠળ, વેચાણ, લીઝ અથવા કોઇપણ પ્રકારે ઇન્ડીયન ઓવરસીઝ બેંકની પૂર્વ લેખિત મંજૂરી વગર સિક્યોર્ડ મિલકતો સ્થાનાંતરિત કરવા માટે મતિબંધિત છે, કોઇપણ વ્યક્તિ જે એક્ટ અથવા રૂલ્સની જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે અથવા ઉલ્લંઘન કરવા પોત્સાહિત કરશે તે એક્ટની ક્લમ રહે હેઠળ આપ્યા મુજબ કેદ અને /અથવા દંડને પાત્ર થશે.

તારીખ : ૦૨.૦૮.૨૦૨૪ સ્થળઃ જેતપુર

નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.

અધિકૃત અધિકારી, ઈન્ડિયન ઓવરસીઝ બેંક



ૠણ વસૂલી અધિકરણ-૧

नाशां मंत्रालय, नाशांडिय सेवा विભाગ, ભाરत सरકार

ચોથા માળે, ભિખુભાઈ ચેમ્બર્સ, કોચરબ આશ્રમ પાસે, એલીસબ્રીજ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોર્મ નં. ૨૨ (અગાઉ ૬૨) (રેગ્યુલેશન ૩७(૧) ડીઆરટી રેગ્યુલેશન, ૨૦૧૫) આવક્વેરા અધિનિયમ, ૧૯૬૧ના બીજા શેડ્યુલના નિયમો ૫૨(૧) જુઓ.

ઈ-હરાજી-વેચાણ નોટીસ રજી.એડી / દસ્તી / જોડાણ / ઢોલના અવાજ દ્વારા

રીકવરી ઓફ ડેટ્સ ડ્યુ ટુ બેંક એન્ડ ફાયનાન્સિયલ એક્ટ ૧૯૯૩ને વંચાણમાં લઇ આવકવેરા ધારા ૧૯૬૧ના બીજા શિડ્યુલના રૂલ્સ ૩૮, ૫૨(૨) હેઠળ વેચાણનું જાહેરનામું

સર્ટીફીકેટ ધારકઃ પંજાબ નેશનલ બેંક વિરૂધ્ધ

સર્ટિફિકેટ દેવાદારઃ નીતીનભાઈ ઘનશ્યામભાઈ મહેતા અને અન્યો

આર.સી નં. ૪૧/૨૦૨૦ ઓ.એ. નં. ૩७૯/૨૦૧૯

સી.ડી.નં. ૧ : નીતીનભાઈ ઘનશ્યામભાઈ મહેતા

સી.ડી.નં. ૨ : સાવન નીતીનભાઈ મહેતા સી.પ્રે.નં. ૧ અને ૨ ના સરનામા: એ/૩૩, ખોડીયાર ક્રયા, C/o. ઈન્ડીયા કોલોની, મેઈન રોડ સામે, બાલેશ્વર ગોલ્ડ પાસે, અમદાવાદ-૩૮૦૦૫૮. **તે ઉપરાંત**

ઘર નં. ૩બી, શ્રી બાલાજી હેરીટેજ વીલા, એસ.જી. હાઈવે, અમદાવાદ. **તે ઉપરાંત** બી-૫૦૭/એ, પાંચમા માળે, મોન્ડીયલ સ્કવેર, વેજલપુર, અમદાવાદ. **નામદાર પ્રિસાઈર્ડીંગ અધિકારી ડીઆરટી - ૧** તરફથી જારી કરવામાં આવેલા વસલાત પ્રમાણપત્ર અનસાર **નીતીનભાઈ ઘનશ્યામભાઈ મહેતા અને અન્યો** ને **રૂા. ૪૦,૩૫,૯૫૩.૫૪ (રૂપિયા ચાલીસ લાખ પાંત્રીસ હજાર નવસો ત્રેપન અને ચોપ્પન પૈસા પુરા)** (બાદ વર્તમાન પુન:પ્રાપ્તિની કાર્યવાહી દરમ્યાન પ્રાપ્ત થયેલ ૨કમ) ઉપરાંત ચૂકવવાપાત્ર વ્યાજ અને ખર્ચની વસુલાત માટે નીચે દર્શાવેલી મિલકત **તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ જાહેર ઈ-હરાજી દારા વેચાણ કરવામાં આવશે.**

	મિલકતનું વર્ણન		
લોટ નં.	સહમાલિકોના નામ સાથે વેચાણ કરવાની મિલકતનું વર્ણન કે જેમાં મિલકત દેવાદારની માલિકીની છે અને અન્ય કોઈ વ્યક્તિ સહ-માલિક તરીકે છે.	અનામત કિંમત જેનાથી ઓછી કિંમતે મિલકત વેચાશે નહી.	અનામત કિંમતના ૧૦% ઈએમડી કે રાઉન્ડેડ રકમ
٩.	મિલકતના એક માત્ર માલિક ના તમામ ભાગ, હક્ક, હીસ્સા, પેટા પ્લોટ નં. ૯૦ (પ્લાન મુજબ ઘર નં. ડી-૪) જમીન ક્ષેત્રફળ ૧૧૧.૦૦ ચો.વાર એટલે કે ૮૩.૬૧.૨૦ ચો.મી. સાથે ચાઉન્ડ ક્લોર અને પહેલા માળનું બાંધકામ સાથે સરખા ભાગની અવિભાજીત સોસાયટીની જમીન સાથે કોમન એમેનીટીઝની વપરાશ હક્ક સાથે, રૂપીકેશ ધામ - ૨, રૂપીકેશ કો.ઓપ.હા.સો.લી., વિભાગ-૨, સર્વે નં. ૧૨૦૫ પૈકી ૧ જમીન ક્ષેત્રફળ ૭૪૮૨.૦૦ ચો.મી. સીટી સર્વે નં. ૩૧૨૫ (૪૭/૮૩) પૈકી મૌજે (સીમ) સાણંદ, તાલુકાઃ સાણંદ, રજી. જીલ્લો અમદાવાદ, પેટા-જીલ્લો સાણંદ, જીલ્લો અમદાવાદ.	રૂા. ૨૪,૫૦,૦૦૦/-	રૂા. ૨,૪૫,૦૦૦/-

મિલકત કે તેના કોઇપણ ભાગ માટે આકારેલ કરઃ જાણમાં નથી

અન્ય કોઈ કરજનો બોજની વિગતો કે જે અદ્ય કરવા મિલકત જવાબદ્યર છે.: જાણમાં નથી આકારણી તેમજ સર્ટિફ્રીકેટ દેવાઘર તરીકે જો કોઈ આકારણી આપવામાં આવી હોય તો તે જણાવો. : નથી

જો મિલકત પર કોઈ દાવો કરવામાં આવ્યો હોય તેની વિગતો અને તેના સ્વરૂપ અને મૂલ્ય પર અસરકર્તા અન્ય કોઈ જાણીતી વિગતો : જાણમાં નથી

૧ હરાજીબિડિંગ (બોલી) ઈ-હરાજી વેબસાઈટ એટલે કે <u>https://www.ebkray.in</u> દ્વારા માત્ર ઓનલાઈન ઈલેક્ટ્રોનીક માધ્યમથી જ થશે.

ઈચ્છિત બોલીદારોએ (બિડર્સ) સર્વિસ પ્રોવાઈડર સાથે તેમની સામેલગીરી અગાઉ રજીસ્ટર કરાવીને ઈ-હરાજીમાં ભાગ લેવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે. નીચે દર્શાવેલ નિયત મોડમાં જરૂરી અર્નેસ્ટમની (બાનાની ૨કમના નાણા) જમા કરાવ્યા બાદ જ તે મેળવી શકાશે

3 ઈ-હરાજીની વેબસાટઈટ એટલે કે https://www.ebkray.in દ્વારા ઈએમડીની રકમ ઈબીક્રે વોલેટમાં જમા કરાવવાની છેલ્લી તારીખ ૧૭.૦૯.૨૦૨૪, **સાંજે ૪:૦૦ વાગ્યા સુધી** રહેશે, ત્યારબાદ જમા કરવામાં આવેલ ઈએમડીને હરાજીમાં ભાગ લેવા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

૪ ઉપરોક્ત ઉપરાંત, પાનકાર્ડ, સરનામાના પૂરાવા અને ઓળખના પૂરાવા, ઈ-મેલ આઈડી, મોબાઈલ નં. અને કંપનીના કિસ્સામાં કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા પાસ કરવામાં આવેલા બોર્ડ ઠારવની નકલ અથેવા કંપનીના પ્રતિનિધિત્વ/એટર્નીને સમર્થન આપતો અન્ય કોઈ દસ્તાવેજ અને આ પ્રકારની ડિપોઝીટની રસીદ/કાઉન્ટર ફાઈલ ૧૭.૦૯.૨૦૨૪, **સાંજે ૪:૦૦ વાગ્યા સુધી** કે તે પહેલા સોફ્ટકોપીઝ અપલોડ કરીને ઈ-હરાજી વેબસાઈટ દ્વારા ઉક્ત સર્વિસ પ્રોવાઈડર્સને પહોંચવી જોઈએ. અને તે ઉપરાંત હાર્ડકોપી સાથે ઈએમડી ડીપોઝીટની પહોંચ **રીકવરી ઓફીસર-૧, ડીઆરટી-૧, અમદાવાદ ઓફીસે તા. ૧૭.૦૯.૨૦૨૪** ના રોજ મોકલી આપવાની રહેશે. એવું પણ ઠરાવવામાં આવે છે કે નિષ્ફળ બોલીદારોના અર્નેસ્ટમની આજ પેમેન્ટના મોડ દ્વારા આવા બોલીદારના પોતાના ખાતામાં પરત કરાશે .

સંભવિત ભાવી બોલીદારો આ સર્વિસ પ્રોવાઈડર પાસેથી ઓનલાઈન ટ્રેનીંગ મેળવી શકે છે.

હરાજી એજન્સીનું નામ	પીએસબી એલાયન્સ (ઈબીક્રે ઈ-હરાજી પોર્ટલ)
સરનામું	યુનીટ ૧, ત્રીજા માળે, વીઆઈઓએસ કોમર્શીયલ ટાવર, વગ્રલા ટ્રક ટર્મીનલ, વગ્રલા પૂર્વ, મુંબઈ-૪૦૦૦૩૭.
હેલ્પલાઈન નંબર	+91 8291220220
વેબસાઈટ અને ઈ-મેલ સરનામું	Website: https://www.ebkray.in Email: psba@psballiance.com
હરાજી. મિલકત સંબંધિત પછ-પરછ માટે સંપર્ક	શ્રી વિનોદ મીના, મો.: +91 7507579015, Email: cs4517@pnb.co.in

- ६ સંભવિત ભાવિ બોલીકારોને તેમની બોલી સુપરત કરતા પહેલા વેચાણની વિસ્તૃત શરતો અને નિયમો અને પ્રક્રીયા જાણવા માટે વેબસાઈટ:https://www.ebkray.in ની મુલાકાત લઈ શકે છે.
- રિઝર્વ કિંમતથી નીચેની કિંમતે મિલકતનું વેચાણ કરવામા આવશે નહિં
- ૮ મિલકતો એક લોટમાં વેચવામાં આવશે- જેની રિઝર્વ કિમત ઉપરોક્ત જણાવેલ છે.
- ૯ બોલી દાર સમગ્ર હરાજી સમયગાળા દરમ્યાન લોટ નં. ૧ માટે રૂા. ૧૦,૦૦૦/- ના એકમમાં ઓફર સુધારી શકશે.
- ૧૦ મિલકતનો 'જ્યાં છે જેમ છે' તે ધોરણે વેચવામાં આવશે અને ઈ-હારજી એજન્સીની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલા અન્ય શસ્તો અને નિયમોને આધિન રહેશે

૧૧ સર્વોચ્ચ બોલીદારે ચૂકવેલી ઈએમડીના એડજસ્ટમેન્ટ બાદ બેંક કામકાજના બીજા દિવસે **સાંજે ૪.૦૦ વાગ્યા** સુધીમાં નીચે દર્શાવેલા બેંક ખાતામાં આરટીજીએસ એનઈએફટી દ્વારા પોતાની આખરે બોલીના ૨કમના ૨૫% જમા કરાવવાના રહેશે.

લાભાર્થી બેંકનું નામ	પંજાબ નેશનલ બેંક
લાભાર્થીનું નામ	Sundry, NPA, SARFAESI, Auction related
લાભાર્થીનો એકાઉન્ટ નં.	451700317118A
આઈએફએસસી કોડ	PUNB0451700
ગાખા	સર્કલ સરવા. અમદ્યવાદ

૧૨ સફળ બોલીદ્યર/હરાજી ખરીદદાર મિલકતના વેચાણની તારીખથી ૧૫માં દિવસે કે તે પહેલા વેચાણની રકમની બાકીની ૭૫% રકમ જમા કરાવવાની રહેશે. જો ૧૫મો દિવસ રવિવાર કે અન્ય કોઈ રજા હોય તો ત્યારબાદના પ્રથમ બેંક કામકાજના દિવસે ઉપર જણાવ્યા મુજબના ખાતામાં આરટીજીએસ / એનઈએફટી દ્વારા નાણાં જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ખરીદનાર કુલ વેચાણ કિંમતના નાણાંના એક ટકાના દરે (વત્તા રૂા. ૧૦) ધ રજીસ્ટ્રાર, શ્રેઆરટી-૧, અમદાવાદની તરફેણમાં શ્રેશ દ્વારા પાઉન્ડેજ ફી ની તરફેણમા તૈયાર કરાયેલ ઊંડી રીકવરી ઓફીસર, ડીઆરટી-૧, અમદાવાદને સીધો સુપ્રત કરાશે.

૧૩ નિયત સમયમર્યાદ્યમાં પેમેન્ટ ચૂકવાવામાં કસૂર થશે તો વેચાણના ખર્ચની કપાત કર્યા બાદ નીચે સહી કરનારને યોગ્ય જણાશેતો ડીપોઝીટ સરકારી ખાતામાં જપ કરવામાં આવશે અને કસુરદાર ખીરદનાર મિલકત કે જમા કરાવેલ રકમ પરના તેના તમામ દાવાઓ જામ કરવામાં આવશે . વેચાણનું નવેસરથી જાહેરનામું જારી કચયા બાદ મિલકત તત્કાલ ફરીથી વેચવામાં આવશે. વધુમાં ખરીદનાર આખરી બોલીની ૨કમ અને પાછળથી જે કિંમતે વેંચાયુ તે કિંમત વચ્ચેનો કોઈ શોર્ટ ફોલ કે તફાવત ભરપાઈ કરવા જવાબદ્યર રહેશે. ૧૪ સફળ બીડરે નોંધ લેવી કે ટીડીએસ અને જીએસટીની જબાવદારી, જો કોઈ હોય તો , સફળ બીડર દ્વારા વેચાણની વિચારણની રકમથી વધુ અને અલગથી વહન રહેશે અને

આ ફોરમ દ્વારા પુષ્ટિ થયેલ વેચાણ વિચારણાની રકમમાંથી બાદ કરવામાં આવશે નહિં.

14 હરાજી ના કાવક્રમ નાચ મુજબ છે.				
નીરીક્ષણની તારીખ અને સમય	०४.०৫.२०२४	બપોરે ૨.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી		
ઈ-હરાજી વેબસાઈટ પર ઈએમડી/દસ્તાવેજોના પૂરાવા અપલોડ કરવાની છેલ્લી તારીખ	૧૭.૦૯.૨૦૨૪	સાંજે ૪.૦૦ વાગ્યા સુધી		
ઈએમડી પ્રુફ અને ડોક્યુમેન્ટ ની હાર્ડકોપી રીકવરી ઓફીસરની ઓફીસએ જમા કરાવવાની છેલ્લી તારીખ	૧૭.૦૯.૨૦૨૪	સાંજે ૫.૦૦ વાગ્યા સુધી		
હરાજીની તારીખ અને સમય	૧૯.૦૯.૨૦૨૪	બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી. (પાંચ મિનિટના ઓટો એક્સટેન્શન સાથે, વેચાણ સમાપ્ર ન થાય ત્યાં સુધી.)		

૧૬ રીકવરી ઓફિસરને કોઈપણ જાતના કારણો આપ્યા વગર કોઈપણ બોલી કે બોલીઓ સ્વીકારવાનો કે અસ્વીકારવાનો અથવા ઈ-હરાજી મોકુફ રાખવાનો કે રદ કરવાનો



Atul

Atul Ltd

Registered office: Atul House, G I Patel Marg, Ahmedabad 380 014, Gujarat, India Corporate identity number: L99999GJ1975PLC002859 Telephone: (+91 79) 26461294 | 26463706 E-mail: shareholders@atul.co.in | Website: www.atul.co.in

NOTICE

Notice is hereby given that the Company has been informed by the following Shareholder(s) that the following equity shares of Rs. 10/- each of the Company have been lost/misplaced.						
Folio	Name	Distinctive Nos.		No. of		
No.	Certificate Nos.	From	To	Shares		
65249	55249 Ramdeo Agrawal					
	368837	14533049	14533098	50		
	368866 to 368872	14533705	14533974	270		
	374895	14630745	14630747	3		

Applications have been made to Atul Ltd. for issue of duplicate certificates for the aforesaid shares. Public is cautioned against purchasing or otherwise dealing with the above mentioned share certificates. A duplicate thereof will be issued to the respective Shareholder(s), unless any objection is received by the undersigned within 15 days from the date of publication of this notice.

Company Secretary and Chief Compliance Officer August 09, 2024

લોકેંઝ ઇશ્વર હોટલ્સ લીમિટેડ

C IN: L55100 GJ 1985PL C008264 રજી.ઓ.ફોટલ રિવાઇવલ, સચાજી ગાર્કન પાસે, કોલાયોડા ચોક, યુવાવિતર્સીટી રેડ, વડોદરા, ગુજરાત ૩૯૦૦૦૨ ટેલિ.: ૦૨૪૫ ૨૭૯૩૫૧૫ ઇંગ્રેઇલ: info@ordsishwar.com, વેલ: www.lordsishwar.com ૩૮મી વાર્ષિક સામાન્ય સભા,ચોપડા બંધ અને ઇ-મતદાન ની માહિતી અંગેની સૂચના

આથી સૂચિત કરવામાં આવે છે કે કંપનીની ૩૮મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) મંગળવાર, ૩જી સપ્ટેમ્બર, २०२४ न। रोष सपारे ११.०० डलाडे पीडीयो डोन्डरन्सींग (पीसी) / अन्य ओडीयो पिञ्युअल भाध्यभो (ઓએવીએમ) દ્વારા એજીએમ સૂચનામાં દર્શાવિલ કામકાજો ને બહાલી આપવાના હેતુસર યોજાશે ઉપરોક્ત સચના તેમજ વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક અઠેવાલોની. જેમના ઇ-મેઇલ આઇડી કંપની / થાપણદારો સાથે

www.lordsishwar.com પર પણ મુકવામાં આવેલ છે. વધુ માં જણાવવાનું કે, કંપનીઘારા, ર૦૧૩ ની કલમ ૯૧ની જોગવાઇને તેના નિયમો સાથે વાંચી અને સેબી (લિસ્ટિટંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૪૪ મુજબ, કંપની ના સભ્યોનું પત્રક અને શેર ટ્રાન્સફરના ચોપડા, કંપનીની એજીએમના કારણે ચટમી ઓગસ્ટ, ચ૦૨૪ થી ૩જી

નોંધાયેલ છે, તેવા શેરધારકોને ઇલેક્ટ્રોનિક નકલો મોકલવામાં આવેલ છે. આજ સૂચના કંપનીની વેબસાઇટ

સપ્ટેમ્બર, ૨૦૨૪ (બંને દિવસો સહિત) બંધ રહેશે. કંપનીધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એક્મિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના નિયમ ૨૦ સાથે વાંચી અને સેબી (લિસ્ટિંગ ઓબિલગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૪૪ મુજબ જણાવવાનું કે કંપની દ્વારા પોતાના શેરધારકો ને એજીએમની સૂચના માં જણાવેલ કામકાજ સંબંધ માં ઇલેક્ટ્રોનિક પ્રણાલી દ્વારા તેના / તેણીના મત આપવા "રિમોટ ઇવોર્ટિંગ" (એજીએમના સ્થળ કરતા બીજા સ્થળેથી ઇલેક્ટ્રોનિક પધ્ધતિ હારા મતદાન) ની સુવિધા આપવામાં આવેલ છે તથા જેની વિગતો નીચે પ્રમાણે

(એ) રીમોટ ઇ-વોર્ટિંગ માટે નો સમય ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ વાગ્યા થી શરૂ થશે. (બી) રીમોટ ઇ-વોર્ટિંગ રજી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા બાદ પુદુ થશે.

(સી) કટ-ઓફ તારીખ રહેમી ઓગસ્ટ, ૨૦૨૪. દા.ત. ઇલેક્ટ્રોનિક માધ્યમથી અથવા એજીએમ માં વોટ આપવા ચોગ્યતા નક્કી કરવાની તારીખ

(ડી) જે વ્યક્તિ એજીએમ ની સૂચના મોકલ્યા પછી અને કટ-એફ તારીખ સુધી કંપનીના શેર ધરાવશે, તેઓ પોતાના ચુઝર આકડી અને પાસવર્ક evoting@nscll.co.in પર દર્શકોઇલ કરીને મેળવી શકે છે અને જો પહેલેથી જ એનએસડીએલની સાથે ઇ-વોરિંગ માટે ૨૭૧૨૨૬ હોય તો હાલનો યુઝર આઇડી અને પાસવર્ડ ઇ-વોરિંગ માટે વાપરી શકાશે.

(ઇ) (i) રીમોટ ઇ-વોટિંગ ૨૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા બાદ નહીં કરી શકાય.

(ii) રિમોટઇ-વોર્ટિંગ દ્વારા મતદાન કરવાની સુવિધા એજીએમમાં બધા માટેઉપલબ્ધ કરાવવામાં આવશે. તે સભ્યો કે જેઓ વીસી / ઓએવીએમ દ્વારા મીટીંગમાં હાજર ક્ષેયછે પરંતુ રિમોટ ઇ-વોરિંગ સુવિધાનો લાભ લઇને તેઓનો મત આપતા નથી. એજીએમ દરમિયાન રિમોટ ઇ-વોટિંગ મોડ્યુલ હશે. જે એનએસડીએલ દ્વારા મીટીંગના સમાપન પછી ૧૫ મીનીટ માટે બંધ કરવામાંઆવશે.

(iii) એક વ્યક્તિ, જેનુ નામ ઉપરોક્ત કટ-ઓફ તારીખે સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા 1ળવવામાં આવેલા લાભકારી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલ છે, તે માત્ર એજીએમ દરમિયાન રિમોટ ઇ-વોટિંગની સવિધા મેળવવા માટે હકદાર હશે.

(ફ) એજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.lordsishwar.com તેમજ એનએસડીએલની વેબસાઇટ w.evoting.nsdl.com પર દર્શાવવામાં આવેલ છે અને

(જ) રીમોટ ઇ-વોટિંગ પ્રક્રિયાને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે જવાબદાર વ્યક્તિનાં સંપર્ક માટે: મીસ પલ્લવી ્રાર્ત્ર, સીનીયર મેનેજર, એનએસડીએલ, મુંબઇ, ઇમેઇલ: evoting@nsdl.com ફોન: 022-48867000 રીમોટ ઇ-વોટિંગ સૂચનાની વધુ માહિતી માટે, મહેરબાની કરીને તમને મોકલાવેલ એજીએમની સૂચનાની નોંધો જુઓ.

બોર્ડ ઓક ડાયરેક્ટર્સના આદેશથી લોકેંઝ ઇશ્વર હોટલ્સ લીમિટેક વતી, સ્થળ : વકોદરા

તારીખ : ઓગસ્ટ ૦૯, ૨૦૨૪

નેહા પ્રજાપતિ

ગુજરાત હોટલ્સ લીમિટેડ

આઇ.એન : એલપ૫૧૦૦જીજે૧૯૮૨પીએલસી૦૦૫૪૦૮ રજીસ્ટર્ડ ઓફીસ : વેલકમ હોટલ વડોદરા, આર.સી.દત્ત રોડ, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭ ટેલિ.: +૯૧ ૦૨૬૫ ૨૩૩૦૦૩૩

ย-भेยตะ ghlinvestors@yahoo.co.in จัดะเยะ: www.gujarathotelsltd.in

નોટીસ

આથી સભ્યોને જણાવવાનું કે કંપનીની ૪૨મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ની નોટીસ ગુરુવાર, ૧૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ सपारे ११.०० **કલાકે** વિડીયો કોન્ફરન્સીંગ/અન્ય ઓડીયો વિઝયુઅલના માધ્યમથી લાગુ પડતા કંપની અધિનિયમ, ૨૦૧૩ ('ધારો') અને નિયમોની જોગવાઇઓ મીનીસ્ટી ઓક કોર્પોરેટ અફેર્સ. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ પરિપત્રો સાથે વાંચી.

૪૨મી એજીએમ ની નોટીસ અને રિપોર્ટસ અને એકાઉન્ટસ ૨૦૨૪, જુરિયાત અનુસાર લાગુ પડતા નિયમ મુજબ જે સભ્યોના ઇમેઇલ સરનામાઓ અથવા થાપણો કંપનીમાં નોંધાયેલ છે, તેઓને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવામાં આવશે. આ જણાવેલ એજીએમની નોટીસ અને રિપોર્ટસ અને એકાઉન્ટસ ૨૦૨૪ કંપનીની વેબસાઇટ (www.gujarathotelsltd.in) અને બીએસઇની વેબસાઇટ (www.bseindia.com) પર પણ ઉપલબ્ધ રહેશે. કંપની શેરધારકોને તેમની વિનંતીથી એજીએમ નોટિસ અને રિપોટસ તથા એકાઉન્ટસ ૨૦૨૪ ની ભોતિક નકલો આપશે.

કાયદાની કલમ અધિનિયમ ૧૦૮ને કંપનીઓના (મેનેજમેન્ટ અને એડમીનિસ્ટેશન) નિયમો,૨૦૧૪ ના નિયમ ૨૦ સાથે વાંચી ૪૨મી એજીએમ ખાતે ઠરાવો પર વિચારણા રીમોટ ઇ-વોટીંગ (એજીએમમાં પહેલા મત આપવાની સુવિધા) અને એજીએમ દરમિયાન ઇ-વોટીંગ થી કરી શકાશે, જે હેતુ માટે નેશનલ સિક્ચોરીટી ડિપોઝીટરી લિમીટેડ ('NSDL')ને કંપની દ્વારા રોકવામાં આવેલ છે.

સભ્યો કે જે સર્ટીફેકેટ ફોર્મમાં શેર ધરાવે છે અથવા જેમણે ઇમેઇલ સરનામા રજસ્ટર કરાવેલ નથી અને એજએમમાં ભાગ લેવા ઇચ્છે છે અથવા મીટીંગ દરમિયાન રીમોટ ઇ-વોટીંગ અથવા ઇ-વોટીંગ દ્વારા પોતાનો મત આપવા ઇચ્છે છે તેઓ તેમના યુઝર આઇડી અને પાસવર્ડ કંપનીમાં પોતાનું ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર કરાવી લિંક https://www.gujarathotelsltd.in/2021/investor-relations/ shareholders-communication/ISR-1.pdf. દ્વારા ફોર્મ ભરી શકશે. મેમ્બર્સ જેઓ ડિમટીરીચલાઇઝ્ડ ફોર્મમાં શેર્સ ઘરાવે છે તેઓને સંબંધિત કિપોઝીટરી સાથેના ઇ-મેઇલ એક્રેસ નોંધણી/અપકેટ કરવા વિનંતી કરવામાં આવે છે.

રૂ.૧૦/- ના દરેક ઇક્વીટી શેર્સનું રૂ. ૨.૫૦/- પ્રતિ શેર પ્રમાણે અંતિમ ડિવિડન્ડ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૩૧મી માર્ચ, ૨૦૨૪ના પૂરા થતા ફાયનાન્શિયલ વર્ષ માટે ભલામણ કરવામાં આવ્યું છે, જે ૪૨મીં એજીએમમાં જાહેર કરવામાં આવશે, કરની કપાત બાદ ઇલેક્ટ્રોનીક માધ્યમ દ્વારા જે સભ્યોએ કંપની / ડિપોઝીટરી સંબંધિત સહભાગીઓને (ડીપીઝ) આપેલ જરૂરી બેંકની માહિતી અનુસાર મોકલવામાંઆવશે.

જે સભ્યોને ડિવીડન્ડની રકમ માટે ઇલેક્ટ્રોનિક માધ્યમ પસંદ કરેલ નથી અને તેના દ્વારા મેળવવા ઇચ્છતા હોય, તેમને પોતાની બેંકની માહિતી, આઇએફએસસી ('ઇન્ડિયન ફાયનાન્શિયલ સિસ્ટમ કોડ') અને એમઆઇસીઆર ('મેગ્નેટીક ઇન્ક કેરેક્ટર રેકગ્નીશન'), થાપણ સંબંધિત સહભાગીઓને, જ્યાં ડિમટીરીયલાઇઝડ ફોર્મ રાખવામાં આવે છે અથવા તો કંપનીમાં, જ્યાં ભૌતિક સ્વરૂપે રાખવામાં આવે છે, તેઓને **૨૩મી ઓગસ્ટ,** ૨૦૨૪ કે તેની પહેલા સુધીમાં મોકલી આપે. તેમાં નિષ્ફળ થવા પર डिपीडंड पोरंन्ट/डिमान्ड ड्राइट तेमनां नोंधायेलासरनामा पर मोडली આપવામાં આવશે. જે સભ્યો સર્ટીફીકેટ સ્વરૂપે શેર્સ ધરાવે છે તેઓ પોતાના એકાઉન્ટની માહિતી https://www.gujarathotelsltd.in/2021/investorrelations/shareholders-communication/ISR-1.pdf ના ઉપર લખીને મોકલી આપે. ગુજરાત હોટલ્સ લીમિટેડ

તારીખઃ ૯મી ઓગસ્ટ,૨૦૨૪

કંપની સેક્રેટરી

HAMILTON POLES MANUFACTURING CO LTD CIN No: L28991WB1981PLC033462 7A, BROJA DULAL STREET, KOLKATA-700006 UNAUDITED FINANCIAL RESULTS FOR QUARTER ENDED ON 30TH JUNE,2024

		110. L	add dhoopt Li o		
PARTICULARS	QUARTER	YEAR ENDED			
PARTICULARS	30-06-2024	30-06-2023	31-03-2024		
	(Unaudited)	(Unaudited)	(Audited)		
Revenue					
Total Income	0.450	10.690	39.310		
Expenses					
Total expenses	1.930	10.350	38.350		
Profit before Exceptional Items and Tax (1 - 2)	(1.480)	0.340	0.960		
Exceptional Items	-	-			
Profit Before Tax (3 - 4)	(1.480)	0.340	0.960		
Tax Expense	-	0.090	0.250		
Profit for the year (5-6)	(1.480)	0.250	0.710		
Other Comprehensive Income (net of tax)					
Total Comprehensive Income for the year	(1.480)	0.250	0.710		
Paid-up equity share capital					
(Face Value of the Share Rs.10/- each)	20,00,000	20,00,000	20,00,000		
Earning Per Share (of Rs.10/-each)					
Basic	-0.740	0.125	0.355		
Diluted	-0.740	0.125	0.355		
Note:					

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI(Listing and Other Disclosure Requirements) Regulations, 2015

HAMILTON POLES MANUFACTURING CO LTD

Name : PRIYANKA JHA
Designation : Managing Director
DIN : 08943236

KALPATARU ENGINEERING LIMITED egistered Office : 18, RABINDRA SARANI, PODDAR COURT, GATE NO 4, 4TH FLOOR, ROOM NO 4, KOLKATA-700001 CIN:L27104WB1980PLC033133 STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2024 Rs. Lacs except EPS

	1.00			
		QUARTI	YEAR ENDED	
SI	PARTICULARS	30-Jun-24	30-Jun-23	31-Mar-24
No.		(Unaudited)	(Unaudited)	(Audited)
1	Revenue			
ı	Total Income	6.56	9.27	186.57
2	Expenses			
ı	Total expenses	5.65	8.19	175.57
3	Profit before Exceptional Items and Tax (1 - 2)	0.91	1.08	11.00
4	Exceptional Items	0.00	0.00	0.00
5	Profit Before Tax (3 - 4)	0.91	1.08	11.00
6	Tax Expense	0.24	0.28	2.86
7	Profit for the year (5-6)	0.67	0.80	8.14
8	Other Comprehensive Income (net of tax)			
9	Total Comprehensive Income for the year	0.67	0.80	8.14
10	Paid-up equity share capital			
ı	(Face Value of the Share Rs.10/-each)	18,21,34,000	18,21,34,000	18,21,34,000
11	Earnings per share (of Rs. 10/- each):			
ı	(a) Basic	0.004	0.004	0.045
	(b) Diluted	0.004	0.004	0.045
Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed				

with the Stock Exchange under Regulation 33 of the SEBI(Listing and Other Disclosure equirements) Regulations, 2015.

For Kalpataru Engineering Limited Sailen Roy Managing Director DIN No. 09673558

इंडियन बैंक 🚓 Indian Bank

Place: Kolkata Date: 09/08/2024

Place: Kolkata Date: 09.08.2024

દુકાન નં. ૧, ૨, ૩, ચાર રસ્તા ચેમ્બર, ન્યુ ફેન્ડ્સ પેટ્રોલિયમ, એમ.જી. રોડ, પોરબંદર, ગુજરાત - ૩૬૦૫७૫

ર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૧) હેઠળ) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

આથી નીચે સહી કરનાર **ઇન્ડિયન બેંક**ના અધિકૃત અધિકારીએ सिड्योरीटार्राजेशन એन्ડ रीडन्स्ट्रङशन ओङ् झयनान्सियस अेसेट्स એन्ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની નિચમ ૮ અને ૯ સાથે વંચાતી ક્લમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ **તા. ૩૦.૦૪.૨૦૨૪** ના રોજ માંગણા નોટિસ જારી કરી અમારી **એમજી રોડ પોરબંદર શાખા** સાથેના દેવાદાર **શ્રી ઓડેદ્રા દિલીપ** મંદનભાઈ (દેવાદાર અને ગીરવેદાર) અને શ્રીમતી ઓડેદ્રા મંજુબેન મંદન (જામીનદાર)ને નોટીસમાં જણાવેલ તા. ૩૦.૦૪.૨૦૨૪ મુજબની ૨૬મ રૂા. ૮,૧૬,૨૧૫.૦૦ (રૂપિયા આઠ લાખ સોળ હજાર બસો પંદર પુરા) અને તેની પરનું વ્યાજ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

દેવાદાર/ગીરવેદાર/જામીનદાર આ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર/ગીરવેદાર/બમીનદાર અને બહેર બનતાને આ નોટિસથી બણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે સદરહુ નિયમોના નિયમ ૮ અને ૯ સાથે વંચાતી સદરહુ એક્ટની ક્લમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત થયેલી સત્તાની રૂએ નીચે દર્શાવેલી મિલકતનો **તા. ૦૫મી ઓગસ્ટ, ૨૦૨૪** ના રોજ કબજો લઈ લીધો છે. આથી ખાસ કરીને દેવાદાર/ગીરવેદાર/જામીનદાર અને જાહેર જનતાને મિલકત

સાથે સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ઇન્ડિયન બેંક, એમજી રોડ શાખાની તા. ૩૦.૦૪.૨૦૨૪ મુજબની ૨કમ રા. ૮,૧૬,૨૧૫.૦૦ (રૂપિયા આઠ લાખ સોળ હજાર બસો પંદર પુરા) તરીકેની રકમ ને તેના પરના વ્યાજને આધિન રહેશે અમે સરફૈસી એક્ટની ક્લમ ૧૩(૮) અને તેની હેઠળ ઘડવામાં આવેલા નિયમો ની

જોગવાઈઓ તરફ તમારૂ ધ્યાન દોરીએ છીએ જે સિક્યોરિટીઝ પર તમારા ગીરોમુક્તિના અધિકારો સાથે સંબંધિત છે.

स्थावर भिलङतनी विगत રહેણાંક મિલકતના તમામ પીસ અને પાર્સલ , આર.એસ . નં . ૭૮૨ , ૭૮૩ , ૭૮૪/૧ પૈકી ,

પ્લોટ નં. ૧૩૯ પૈકી, બ્લોક નં., ટેનામેન્ટ નં. "એ", કે.કે.નગર, બોખીરા, ગામ-બોખીરા, તા. અને જી. પોરબંદર, ગુજરાત-૩૬૦૫૫૦. અંદાજીત ક્ષેત્રફળ૩૧.૧૦ ચો.મી. **ચતુઃસીમા : ઉત્તર :** ટેનામેન્ટ નં. "બી"ની મિલકત , **દક્ષિણ :** પ્લોટ નં. ૧૩૮ની જમીન , **પૂર્વ** : ૭.૫૦ ચો .મી .પહોળો રોડ ,**પશ્ચિમ :** પ્લોટ નં . ૧૪૦ની જમીન . મિલકતના માલિક : શ્રી ઓડેદ્રા દિલીપ મંદનભાઈ

નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.

તારીખ : ૦૫.૦૮.૨૦૨૪ સ્થળ : પોરબંદર

સીચા કોમ્પલેસ, ૧૯૪, ડીબીઝેક દક્ષિણ, શિવાજી ૫૦લીક ગાર્ડનની સામે, ગાંઘીઘામ (કચ્છ), ગુજરાત ફોન/ફેક્સ: ૦૨૮૩૬૨૨૯૪૯૪ ป-มัด: g519@indianbank.co.in

સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૮(૧) હેઠળ કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે) આથી નીચે સહી કરનારે **ઇન્ડિયન બેંકના** અધિકૃત અધિકારી તરીકે

सिड्योरीटार्राजेशन એन्ડ रीडन्स्ट्रङ्शन ओङ् झयनान्सियल अेसेट्स એन्ड એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ અને ૯ સાથે વંચાતી ક્લમ ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત સત્તાની રૂએ **તા. ૩૧.૦૫.૨૦૨૪ ના રોજ** માંગણા નોટિસ જારી કરી અમારી **આદીપુર રોડ, ગાંધીધામ શાખા** સાથેના દેવાદાર શ્રીમતી ચામપલ્લી મોનીકા (દેવાદાર અને ગીરવેદાર), શ્રી ચામપલ્લી રાજેશ (સહ-દેવાદાર)ને માંગણા નોટીસમાં જણાવેલ તા. ૩૧.૦૫.૨૦૨૪ મુજબ રૂા. **૯,૩૧,૯૬૮.૦૦ (રૂપિયા નવ લાખ એક્ત્રીસ હજાર નવસો અકસઠ પુરા)** થી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

દેવાદાર/ગીરવેદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતાં આથી દેવાદાર/ગીરવેદાર અને જાહેર જનતાને આ નોટિસથી જાણ કરવામાં આવે છે કે નીચે સહી કરનારે કથિત નિયમોના નિયમ ૮ અને ૯ સાથે વંચાતી કાયદાની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાની રૂએ નીચે દર્શાવેલી મિલકતનો **તારીખ ૦૯મી ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ** કબજો લઈ લીદ્યો છે.

આથી ખાસ કરીને દેવાદાર/ગીરવેદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઈ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદાનો ચાર્જ ઈન્ડિયન બેંક, આદિપુર રોડ ગાંધીધામ શાખા ની તા. ૩૧.૦૫.૨૦૨૪ મુજબ રૂા. ૯,૩૧,૯૬૮.૦૦ (રૂપિયા નવ લાખ એક્ત્રીસ હજાર નવસો અડસઠ પુરા) તરીકેની રકમ અને તેની પરના વ્યાજને આધિન રહેશે.

અમે સરફેસી એક્ટની ક્લમ ૧૩(૮) અને તેની હેઠળ ઘડવામાં આવેલા નિયમો ની જોગવાઈઓ તરક તમારૂ ધ્યાન દોરીએ છીએ જે સિક્યોરિટીઝ પર તમારા ગીરો મુક્તિના અધિકારો સાથે સંબંધિત છે.

સ્થાવર મિલકતનું વર્ણન

રહેણાંક મકાનના તમામ પીસ અને પાર્સલ, પ્લાટ નં. ૭૨, પિંક સીટી, સર્વે નં. ૧૫૩/પૈકી-૨, ગામ - કિડાણા, તા. ગાંધીધામ, જી. કચ્છ, રાજ્ય ગુજરાત-૩૭૦૨૦૧ જે શ્રીમતી ચામપલ્લી મોનીકાના નામે છે. (અંદાજીત ક્ષેત્રફળ-પક.૦૦ ચો.મી.) ચતુઃસીમા : ઉત્તર : પ્લોટ નં. ૭૭, દક્ષિણ : પ્લોટ નં. ૭૯, પૂર્વ : ૩.૦૦ ચો.મી. પહોળી લેન ત્યારબાદ પ્લોટ નં. ૬૪ , **પશ્ચિમ :** ૯.૦૦ મી . રોડ

મિલકતના માલિક : શ્રીમતી ચામપલ્લી મૌનીકા

ચીફ મેનેજર અને અધિકૃત અધિકારી તારીખ : ૦૯.૦૮.૨૦૨૪ ઈન્ડિયન બેંક (અગાઉ અલાહાબાદ બેંક) વતી સ્થળ : ગાંધીધામ

નોંધ : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.

તા. ૦૮.૦૮.૨૦૨૪ના રોજ મારા હસ્તાક્ષ અને આ અધિકરણની મહોર સાથે જારી કરાયું.

સહી/- (લવ કુમાર) વસૂલાત અધિકારી-૧, ડીઆરટી-૧, અમદાવાદ